

# IIT-gnમાં સ્ટોન બિઝનેસના વર્કશોપમાં રજિસ્ટ્રેશન 31મે સુધી

સિટીરિપોર્ટર • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગરનાં આર્કિયોલોજી સાયન્સ સેન્ટર દ્વારા સ્ટોન બિઝનેસનાં અભ્યાસ માટેનો શોર્ટ ટર્મ કોર્સ કમ વર્કશોપનું આયોજન 10થી 14 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસ દરમિયાન યોજવામાં આવેલાં કોર્સમાં સ્ટોન બિઝનેસની હિસ્ટ્રી, સાયન્સ અને ટેકનોલોજી વિશે શીખવવામાં આવશે. આ માટે દુનિયાભરમાંથી જાણીતાં એક્સપર્ટ્સ અને ખંભાતનાં કાફ્ટ્સમેન વિદ્યાર્થીઓને શીખવશે. આ માટે આર્કિયોલોજીસ્ટનાં વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, રિસર્ચ સ્કોલર્સ, ફેકલ્ટી અને સ્ટાફ ભાગ લઈ શકશે. એપ્લિકેશન્સને સ્કીનિંગ કર્યા પછી વધુમાં વધુ માત્ર 40 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. આ માટે 31મી મે સુધીમાં એપ્લિકેશન સાથે બાયોડેટા મોકલીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.